



K.P. ENERGY LIMITED

CIN: L40100GJ2010PLC059169



KPEL/NP/JAN/2026/627

January 22, 2026

BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400001

National Stock Exchange of India Limited
Exchange Plaza,
Bandra Kurla Complex,
Bandra (E), Mumbai - 400051

Scrip Code: 539686

Symbol: KPEL

Sub:Newspaper Publication of Unaudited Financial Results for the quarter and nine months ended December 31, 2025

Dear Sir,

Pursuant to Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of newspaper publication of the unaudited financial results for the quarter and nine months ended December 31, 2025, published in *The Indian Express* (English) and *Financial Express* (Gujarati), both dated January 22, 2026. The relevant copies of the said newspapers are enclosed herewith.

Kindly take the above information on your record.

Thanking You,

Yours faithfully,
For K.P. Energy Limited

Affan Faruk Patel
Whole Time Director
DIN: 08576337

Encl.: a/a

Reg. Office:

'KP House', Near KP Circle, Opp. Ishwar Farm Junction BRTS, Canal Road, Bhatar, Surat-395017, Gujarat

Phone: +91-261-2234757, Fax: +91-261-2234757

E-mail: info@kpenergy.in, Website: www.kpenergy.in

ISO 14001:2015, ISO 9001:2015 and ISO 45001: 2018 Certified Company

NSE BSE Listed Company



K.P. ENERGY LIMITED

Regd. Office: 'KP House', Near KP Circle, Opp. Ishwar Farm Junction BRTS, Canal Road, Bhatar, Surat – 395017, Gujarat, India
Tel /Fax: (0261) 2234757 | E-mail: info@kpenergy.in
Website: www.kpenergy.in | CIN: L40100GJ2010PLC059169

Statement of Unaudited Financial Results (Standalone and Consolidated) for the Quarter and Nine Months ended December 31, 2025

The Board of Directors of the Company, at its meeting held on **January 21, 2026**, approved the Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the quarter and nine months ended December 31, 2025 ("Financial Results").

The Financial Results, along with the Limited Review Report, are available on the website of the Stock Exchanges—BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com, and are also been hosted on the Company's website at: <https://kpenergy.in/financial-Results>. The same can be accessed by scanning the QR code.



For K.P. Energy Limited

Sd/-
Affan Faruk Patel
Whole Time Director
DIN: 08576337

Place: Surat
Date: January 21, 2026

Note: The above intimation is in accordance with Regulation 33 read with regulation 47 (1) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

IIFL HOME LOAN

IIFL Home Finance Limited

CIN: U65993MH2006PLC166475

Regd. Office -IIFL House, Sun Infotech Park, Road No. 16V, Plot No. B-23, MIDC, Thane Industrial Area, Wagle Estate, Thane-400604, Maharashtra | Tel: (91-124) 478 0900
Fax: (91-22) 2580 6654 | Email: secretarialhfc@iiflhomeloans.com | Website: www.iiflhomeloans.com

STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED DECEMBER 31, 2025

₹ in crore except otherwise stated

S. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Year Ended
		December 31, 2025	December 31, 2024	March 31, 2025
1	Total Income from Operations	957.34	897.97	3,711.56
2	Net Profit / (Loss) for the period / year (before Tax, Exceptional and/or Extraordinary items*)	229.40	270.24	1,279.84
3	Net Profit / (Loss) for the period / year before tax (after Exceptional and/or Extraordinary items*)	229.40	270.24	1,279.84
4	Net Profit / (Loss) for the period / year after tax (after Exceptional and/or Extraordinary items*)	177.93	207.05	995.15
5	Total Comprehensive Income for the period / year [Comprising Profit / (Loss) for the period / year (after tax) and Other Comprehensive Income (after tax)]	183.37	196.84	984.98
6	Paid up Equity Share Capital	26.34	26.34	26.34
7	Reserves (excluding Revaluation Reserve, if any)	7,989.21	7,235.80	7,463.97
8	Securities Premium Account (included in Sl. No.7-Reserves)	2,969.65	2,969.65	2,969.65
9	Net worth	8,015.56	7,262.15	7,490.31
10	Paid up Debt Capital / Outstanding Debt	19,964.45	19,053.36	19,574.28
11	Outstanding Redeemable Preference Shares	Not Applicable	Not Applicable	Not Applicable
12	Debt Equity Ratio	2.49	2.62	2.61
13	Earnings Per Share (of ₹10/- each) (for continuing and discontinued operations) (not annualised for the quarters)			
	• Basic: (₹)	67.54	78.59	377.74
	• Diluted: (₹)	67.05	77.67	373.14
14	Capital Redemption Reserve	Not applicable	Not Applicable	Not Applicable
15	Debenture Redemption Reserve	Not applicable	Not Applicable	Not Applicable
16	Debt Service Coverage Ratio	Not applicable	Not Applicable	Not Applicable
17	Interest Service Coverage Ratio	Not applicable	Not Applicable	Not Applicable

- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules/ AS Rules, whichever is applicable.

Note:

- The above mentioned results for the quarter ended December 31, 2025 have been reviewed and recommended by Audit Committee and subsequently approved by the Board of Directors on January 20, 2026. The Joint Statutory Auditors of the Company have carried out the Limited Review of aforesaid results and have issued an unmodified conclusion.
- The above is an extract of the detailed format of financial results for the quarter ended December 31, 2025 filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"). The full format of the financial results are available on National Stock Exchange of India Limited (NSE): www.nseindia.com, BSE Limited (BSE): www.bseindia.com and can be accessed on the website of the Company: www.iiflhomeloans.com/investor-relations/financials.
- For the other line items referred in Regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to Stock Exchanges and available on NSE: www.nseindia.com, BSE: www.bseindia.com and can be accessed on the website of the Company: www.iiflhomeloans.com/investor-relations/financials.
- The Board of Directors at its meeting held on January 20, 2026 has declared an interim dividend of ₹55 per equity share (face value of ₹10 each).
- On November 21, 2025, the Government of India notified provisions of the Code on Wages, 2019, the Industrial Relations Code, 2020, the Code on Social Security, 2020 and the Occupational Safety, Health and Working Conditions Code, 2020, ('Labour Codes') which consolidated twenty-nine existing labour laws into a unified framework governing employee benefits during employment and post employment. The Labour Codes, amongst other things introduces changes, including a uniform definition of wages and enhanced benefits relating to leave. As at December 31, 2025, the Company has estimated the incremental financial implications of ₹7.45 crores as increase in gratuity liability arising out of past service cost and increase in leave liability and the same has been recognized as an employee benefit expense during the quarter and nine months ended December 31, 2025.
- The Company will continue to monitor the developments and will give appropriate impact, including implementation of structural changes in the forthcoming periods once the rules under the new Code are notified.
- The Accounting policies adopted in the preparation of the financial results are consistent with those followed in the previous period/year unless otherwise stated.
- Previous year's/periods figures have been regrouped/reclassified wherever necessary to conform to the current period's presentation.

By order of the Board
For IIFL Home Finance Limited

Girish Kousgi
Managing Director & CEO
DIN: 08524205

Date: January 20, 2026

Place: Mumbai

PUBLIC NOTICE

BRANCH OFFICE SHIFTING

Bajaj Finance Limited having its Registered Office, Mumbai- Pune Road, Akurdi, Pune 411 035 and Corporate office on, 4th Floor, Bajaj Finserv House, Viman Nagar, Off Pune - Ahmednagar Road, Pune, Maharashtra 411 014 hereby informs its customers and concerned that its office located at Bajaj Finance Limited, Opp. Khodiyar Temple, Lilcha, Ta- Bhiloda, Di-Araval, Gujarat- 383245 will be closing with effect from 29 April 2026. For better customer facility all the existing services shall continue to be available at new branch shifted to First Floor, Sitaram Complex, CTS No. 2721 & 2722, Hall No. 2, APMC Marketyard Road, Bhiloda, 383245 All customers and concerned are requested to take note of change of address and requested to contact our office at First Floor, Sitaram Complex, CTS No. 2721 & 2722, Hall No. 2, APMC Marketyard Road, Bhiloda, 383245

Bajaj Finance Limited, 4th Floor, Bajaj Finserv House, Viman Nagar, Off Pune - Ahmednagar Road, Pune - 411014 Maharashtra

Place : Lilcha
Date:- 22-01-2026



Transpek Industry Limited
CIN: L23205GJ1965PLC001343

Regd. Office : 4th Floor, Lilleria 1038, Gotri-Sevasi Road, Vadodara - 390021.

NOTICE

NOTICE IS HEREBY GIVEN THAT a meeting of the Board of Directors will be held on **Wednesday, the 4th February, 2026 at 02.00 p.m.** through Audio-Visual means to consider and approve the Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the third quarter ended on 31st December, 2025 as required under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015.

For Transpek Industry Limited

Place : Vadodara
Date : 21.01.2026

Alak D. Vyas
Company Secretary & Compliance Officer

EXPRESS Careers

लक्ष्मीबाई लक्ष्मीबाई विद्यालय LAKSHMIBAI COLLEGE
(लक्ष्मीबाई विद्यालय University of Delhi)
आशोक विहार Ashok Vihar-III, दिल्ली Delhi-110052
Website: lakshmibaicollege.in

Advt. No. LBC/Advt./2026/01 Date: 15/01/2026

Online applications are invited in the prescribed Application Form from eligible candidates for appointment to the post of Principal, in the Academic Pay Level 14 of 7th Central Pay Commission Pay Matrix, in the College. The last date for receipt of application is 04th February, 2026 or two weeks from the date of publication of the advertisement in the Employment News, whichever is later.

Web link for applying online: <http://recruit.uod.ac.in>

For complete details, please visit the College website: lakshmibaicollege.in

Any addendum/corrigendum shall be posted only on the College website.

Chairperson, Governing Body

Important Note: The details regarding qualifications, publications, experience, screening guidelines and indicative proforma etc. are available on the College website along with this advertisement. The applicants are required to read these details before filling up the form.

Mumbai Port Authority
MECHANICAL AND ELECTRICAL
ENGINEERING DEPARTMENT

Applications are invited from eligible Indian Nationals for engagement as i) Jr. Professional Interns (Electrical) in Electrical Division and ii) Jr. Professional Interns (Mechanical) in OPL Division of MbPA purely on contract basis.

Last date of receiving applications is **10/02/2026**.

For details regarding educational qualifications, age, experience, application format etc., please visit our website www.mumbaiport.gov.in (people & career/jobs).

Sd/-
MbPA-44-2025
CHIEF MECHANICAL ENGINEER

MORMUGAO PORT AUTHORITY
GENERAL ADMINISTRATION DEPARTMENT
An ISPS Code Compliant Port
Gatishakti
SAGARMALA

RECRUITMENT NOTICE

Applications, complete in all respects, are invited from eligible candidates for filling up the posts on Regular basis by direct recruitment and also certain contractual engagements in Mormugao Port Authority, Goa to reach to this Office on or before **17.02.2026**.

MODE OF APPOINTMENT : REGULAR

Name of the Post Scale of pay No. of posts Category
Trainee Pilot ₹ 70000 - 200000/- 05 (01-SC, 01-ST, 03-OBC)

Sr. Dy. Secretary ₹ 80000 - 220000/- 01 NA

Dy. Chief Engineer ₹ 80000 - 220000/- 01 NA

Executive Engineer (Civil) ₹ 50000 - 160000/- 01 UR

MODE OF ENGAGEMENT : CONTRACT BASIS

Name of the Engagement Consolidated Monthly Remuneration No. of posts Category
Senior Environmental ₹ 91,000/- 01 NA

Manager ₹ 76,000/- 01 NA

Junior Environmental ₹ 1,20,000/- 01 NA

Manager (BD&TP) ₹ 75,000/- 01 NA

General Duty Doctor ₹ 75,000/- 01 NA

For more details visit our website www.mptgoa.gov.in (M. Sankar Babu Secretary)

Sd/-
S. Principal Investigator

AT : Gothapatna, PO : Malipada, Bhubaneswar - 751003, Odisha, India, Web : www.iiit-bh.ac.in

For more details visit our website www.mptgoa.gov.in (M. Sankar Babu Secretary)

The Advertisement is approved subject to the final decision in the Writ Petition No. 12051/2015

The above post is open to all, however candidates from any category can apply for the post.

Reservation for women will be as per University Circular No. BCC/16/174/1998 dated 10th March 1998. 4% reservation shall be for the persons with disability as per University Circular No. Special Cell/2019-20/05 dated 5th July, 1999.

Candidates having knowledge of Marathi will be preferred.

"Qualification, Pay Scales and other requirement are as prescribed by the UGC Notification dated 18th July, 2018, Government of Maharashtra Resolution No. Misc. 2018/C.R.56/18/UNI-1 dated 8th March 2019 and University circular No. TAAS/(CT)/ICD/2018-19/1241, dated 26th March, 2019 and revised from time to time" The Government Resolution & Circular are available on the website mu.ac.in

Applicants who are already employed must send their application through proper channel.

Applicants are required to account for breaks, if any in their academic career.

Application with full details should reach the Secretary, Chetana, Survey No. 341, Near Government Colony, Bandra (East), Mumbai 400051, within 15 days from the date of publication of this advertisement.

Sd/-
Hon. Secretary

This is University approved advertisement.

